

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૦૩/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૪૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૨ કેસ કરી, ૮૨ વ્યક્તિઓને ઝડપી, ૯૨૪ લીટર દેશી દારૂ, ૨૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩૩ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૮ વ્યક્તિઓને અટક કરી રોકડ રૂપિયા ૨,૦૧,૦૮૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૫૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૪૫૧/૧૮

રાણીપ: પ્રકાશ મુકેશભાઈ સોની (ઉ.વ.૩૬) (રહે. સાંઈ સંસ્કૃત ફ્લેટ દેવહોમ ફ્લેટની બાજુમાં બલોલનગર ચાર રસ્તા રાણીપ) એ તા.૦૫/૦૩/૧૮ નારોજ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૯/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) વિજયસિંહ બહાદુરસિંહ વાઘેલા (રહે. ખુશમન સોસાયટી મેમનગર) (૨) જય હિમતસિંહ પરમાર (રહે. નવગરા શેરી નં-૩/૪૯ સોજીત્રા તા.જી. આણંદ) (૩) વિશાલકુમાર અશોકભાઈ પટેલ (રહે. શાંતીપુરા વોર્ડ નં-૪ સોજીત્રા તા.જી. આણંદ) એ ભેગા મળી પ્રકાશ સોનીને કેનેડા જવા માટે વિઝીટર વર્ક પરમીટ તથા વિઝા અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈ રૂપિયા ૧૧,૭૮,૭૫૦/- તેમજ પ્રકાશ સોની તથા તેમના પત્ની તેમજ પુત્રી એમ ત્રણેયના પાસપોર્ટ લઈ જઈ આજદીન સુધી પરત નહીં કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.કે.રાઠોડ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૪૫૨/૧૮

મણીનગર: મનોજભાઈ ડુંગરભાઈ પરમાર (રહે. બાવન કો.ઓ.પ.સોસાયટી ઢોર બઝાર કાંકરિયા મણીનગર) એ તા.૦૪/૦૩/૧૮ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૩/૧૮ કલાક ૧૨/૩૦ થી સાંજના ૬/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના દાગીના પૈકી સોનાની બંગડી, બુટ્ટી, ચેઈન, વીંટી અને ચાંદીના પાચલ મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એન.વાઘેલા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૪૫૩/૧૮

પાલડી: આનંદ ચંદ્રકાંત શેઠ (રહે.બીપીનવીલા દશા પોરવાડ સોસાયટી પાસે નમો હરી ફ્લેટની સામે પાલડી) એ તા.૨૭/૦૨/૧૮ સાંજના ૭/૩૦ વાગે પાલડી બીપીન વીલા બંગલાના કંપાઉન્ડમાં પોતાની કાર નંબર જીજે ૦૧ આરજી ૪૯૯૫ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૨૮/૨/૧૮ સવારના ૯/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ આનંદ શેઠે તા.૦૫/૦૩/૧૮ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એફ.એ.પારગી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૪૫૪/૧૮

વાસણા: વિષ્ણુ ગીરીરાજ વૈષ્ણવ (ઉ.વ.૨૫) (રહે. ખોડીયાર શેરી સોમેશ્વરનગર વાસણા) એ અગમ્ય કારણસર તા.૦૫/૦૩/૧૮ બપોરના ૩/૩૦ થી સાંજના ૫/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી કનિયાલાલ શેવાભાઈ ચલાવે છે.

નિકોલ: શારદાબહેન વા/ઓ પ્રભુદાસભાઈ સાંચલા (રહે. સહજાનંદવિલા સુર્યનગર સોસાયટીની અંદર સેવન-ડે સ્કુલની પાસે નિકોલ) એ બિમારીથી કંટાળી તા.૦૫/૦૩/૧૮ બપોરના ૧/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પ્રો.પો.સ.ઈ.શ્રી એચ.ડી.વાઢેર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.